

જૂન-2021

## પરિષદવૃત્ત

સંકલન : કીર્તિદા શાહ

મિત્રો,

નમસ્તે,

છેલ્લા દિવસોમાં મહામારીએ આપણા બીજાં કેટલાક મિત્રોથી પણ આપણો વિયોગ કરાવ્યો છે. એ સૌ મિત્રોની ચેતનાને સાદર વંદન કરીએ છીએ. પરમચેતનાએ માનવજાતિની પ્રાર્થના સાંભળી હોવાનો અનુભવ આપણને થઈ રહ્યો છે. મહામારીના વળતા પાણી ત્વરિત થવાની સૌને શુભકામનાઓ.

મુખોમુખ આપણો સાક્ષાત્કાર થાય એવું માધ્યમ આપણી ઓનલાઈન કાર્યક્રમની વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં વિકાસમંત્રીશ્રીના પ્રયત્ન અને સહાયથી પ્રત્યેક મહિને ઓનલાઈન યોજાતો 'વાર્તા રે વાર્તા' કાર્યક્રમ રવિવાર, 16મેના રોજ યોજાયો. કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના જાણિતા વાતાકારો સર્વશ્રી ડૉ.ભારતી રાણે અને દીવાન ઠાકોરની વાર્તાઓનું રસમય પઠન શ્રી યામિની વ્યાસ અને શ્રી પ્રજ્ઞા વશીએ કર્યું. ત્યાર પછી બંને વાર્તાકારોએ પોતાની કેફિયત રજૂ કરી. બંને વાર્તાકાર વિશે એક વાત ધ્યાનપાત્ર બની. બંને મિત્રો સાહિત્યના સીધા વિદ્યાર્થીઓ ન હોવા છતાં તેમની વાર્તા અને તેમની કેફિયત રસાળ બની રહ્યા. વાર્તારસિયા ઘણા મિત્રો કાર્યક્રમમાં જોડાયા અને રસપ્રદ પ્રશ્નોત્તરીથી કાર્યક્રમ જીવંત બની રહ્યો.

પરિષદની વેબસાઈટ પર આપ સૌને વિઝીટ કરવા આમંત્રણ છે. આપણે રૂબરૂ થઈ શકતા નથી ત્યારે સાઈટ પર એક 'શ્રદ્ધાજલિ'નું આયોજન કર્યું છે. અહીં આપણા દિવંગત મિત્રોને અંજલિ આપી છીએ.

ટપાલખાતામાં વારંવાર રૂબરૂમાં ફરિયાદ કર્યા છતાં ઘણા મિત્રોની 'પરબ' ન મળ્યાની અથવા મોડું મળ્યાની ફરિયાદ મળે છે. એવું ન થાય એ માટે પરિષદ સતત પ્રયત્ન કરે છે. પ્રસ્તુત સંદર્ભમાં આપણે 'પરબ' પ્રત્યેક મહિનાની દસ તારીખે આપણી સાઈટ પર મૂકીએ છીએ. આપ ત્યાંથી 'પરબ' ડાઉનલોડ કરી વાંચી શકશો.

જો કોઈ મિત્રો એમના પોતાના મેલઆઈડી પર 'પરબ'નો અંક મેળવવા ઈચ્છતા હોય તો તમારો મેલઆઈડી પરિષદને મોકલશો. અમે મેલમાં 'પરબ' દસ તારીખે જ મોકલીશું.

કસોટીના કપરાકાળમાંથી સમગ્ર માનવજાત પસાર થઈ રહી છે. ઘણા સ્વજનો-મિત્રોની ચેતનાને વંદન કરવા માટે પરિષદે 30 મે 2021ના રોજ ઓનલાઈન 'શબ્દસ્મરણાંજલિ સભા'નું આયોજન કર્યું છે. જેની લિંક સાઈટ પરથી મળશે.